



# ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ - કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર, નાગપુર

ICAR-Central Institute for Cotton Research, Nagpur

An ISO 9001:2015 Certified Organization



## ૨૨ થી ૨૮ ઓગષ્ટ, ૨૦૨૩ દરમાન કપાસની ખેતી પદ્ધતિ માટે ૧૪ મી અઠવાડિક સલાહ

ગુજરાત		છેલ્લા અઠવાડિયામાં પડેલ ખરેખર વરસાદ (મીભી)					આગામી અઠવાડિયા માટે સુચિત / પુર્વાનુમાન વરસાદ (મીભી)				
		ઓગષ્ટ					ઓગષ્ટ				
		૧૮	૧૯	૨૦	૨૧	૨૨	૨૪	૨૫	૨૬	૨૭	૨૮
	અમરેલી	૨.૨	૦	૦	૦	૦	૨	૨	૨	૩	૩
	ભાવનગર	૦	૪.૬	૦	૦	૦	૧	૧	૧	૧	૧
	જામનગર	૦	૦	૦	૦.૪	૦	૨	૨	૨	૩	૩
	રાજકોટ	૦	૦	૦	૨.૮	૦	૧	૨	૨	૨	૨
	જુનાગઢ	૧	૦.૩	૦	૦	૦	૨	૨	૩	૪	૩
	સાબરકાંઠા						૨	૧	૨	૧	૧
	સુરેન્દ્રનગર	૦	૦	૨	૨.૫	૦	૦	૧	૧	૧	૧
	અમદાવાદ	૦	૦	૩	૦	૦	૦	૦	૧	૧	૧
	વડોદરા	૦	૦	૬.૮	૦	૦	૧	૨	૨	૨	૨
	પાટણ	૦	૦	૦	૦	૦.૫	૫	૧	૧	૧	૧
	મહેસૂસાણા						૪	૧	૧	૧	૧
કુલ પડેલ વરસાદ અને પ્રમાણિત રંગ		૦.૧ થી ૨.૪ મીભી	૨.૫ થી ૧૫.૫ મીભી	૧૫.૬ થી ૬૪.૪ મીભી	૬૪.૫ થી ૧૧૫.૫ મીભી	૧૧૫ થી ૨૦૪.૪ મીભી					
પડેલ વરસાદનું વર્ગીકરણ		ખૂબ જ ઓછો વરસાદ	ઓછો વરસાદ	મધ્યમ વરસાદ	ભારે વરસાદ	અતિ ભારે વરસાદ					

### પાક પરિસ્થિતિ :

સુરત ખાતે વાવણી કરેલ પાક પદ થી ૬ ત દિવસનો કળી અને કુલ અવસ્થાએ છે. હાથથી નિંદામણ સફાઈ, આંતર ખેડનાં કાર્યો અને પૂર્તિ ખાતર તરીકે નાઈટ્રોજન ખાતરનો બીજો હપ્તો આપવાની કામગીરી ચાલુ છે. થીસની વસ્તીએ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવેલ છે અને લીલાં તડતરીયાની વસ્તી આર્થિક ક્ષમ્ય માત્રાથી નીચે છે. કેટલાંક સ્થળોએ ખૂબિયાં ટપકાનો રોગ નોંધાયેલ છે.

જુનાગઢ ખાતે વાવણી કરેલ પાક પદ થી ૬ ત દિવસનો વાનસ્પતિક વૃદ્ધિ અને કળી અવસ્થાએ છે. આંતર ખેડની, નિંદામણ સફાઈની, ખાતર આપવાની અને દવા છાંટવાની કામગીરી થયેલ છે. કેટલાંક સ્થળોએ મોલોમશી, લીલાં તડતરીયા અને થીસના ઉપદ્રવએ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવેલ છે. કેટલાંક છુટાછવાયા સ્થળો દુંખનાં ચાંચવા (આલ્સીડોડસ અફાલેર) નાં ઉપદ્રવની શરૂઆત થયેલ છે. કેટલાંક સ્થળોએ ફ્યુઝારીયમ કુગથી થતો સુકારો નોંધવામાં આવેલ છે.

### સલાહ :

સુરત ખાતે ખેડુતોને ખેતર નિંદામણોથી ચોખ્ખા રાખવાની સલાહ આપવામાં આવે છે. માફકસરનો વરસાદ બાદ, પૂર્તિ ખાતર તરીકે નાઈટ્રોજન ખાતરનો બીજો હપ્તો ૫૦ થી ૬૦ વાવેતરનાં દિવસે વાવણી બાદ આપવો. ઉગેલ પાકમાં હલ્કી જમીનમાં જીકની ઉણપને ઓછી કરવા યુરીયા @ ૨.૦% અને જીક સલ્ફેટ ૨૧% @ ૦.૫ અને મેનેશીયમની ઉણપ ઓછી કરવા મેનેશીયમ સલ્ફેટ @ ૧ કિલો/ ૧૦૦ લી. પાણીમાં મિશ્ર કરી છાંટવું. જો યુસીયાં પ્રકારની જીવાતો તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુજી @ ૪ ગ્રામ/ ૧૦ લી. અથવા થાયોમીથોકશામ ૨૫ ડબલ્યુજી @ ૨ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટકાવ કરવો. કપાસનાં પાકને વાનસ્પતિક વૃદ્ધિ અને કળી અવસ્થાએ રોઝે કુલોમાંથી ગુલાબી ઈયળનાં લાર્વાની હાજરીને મોજણી કરી તેનો નાશ કરવો. ગુલાબી ઈયળની મોજણી માટે ફોડોમોન ટ્રેપ (૫ પ્રતિ હેક્ટાર) લગાડવા. જ્યાં ગુલાબી ઈયળ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે (૧૦% ફ્લાઉ ભાગોમાં નુકશાન) ત્યાં કલોર પાયરીફોસ ૨૦ ઈસી @ ૨૫ મીલી અથવા કવીનાલફોસ ૨૦ એએફ @ ૨૦ મીલી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી @ ૩૦ મીલી અથવા ઈન્નોક્ષાકાર્બ ૧૪.૫ એસ્સી @ ૫ મીલી/ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટકાવ કરવો. સુકારા અને મૂળનાં કોહવારા રોગનાં વ્યાસ્થાપન માટે ઉપદ્રવિત છોડોની આજુબાજુ કાર્બેન્ડેજીમ ૫૦% વ.પા. ૨ ગ્રામ/ લી. અથવા ટ્ર્યાયકોર્મા હરજીયમ અથવા ટ્ર્યાયકોર્મા વિરીડી ૧૦ ગ્રામ/ લી. પાણીમાં આપવું અને દેશી કપાસમાં ફ્યુઝારીયમ કુગથી થતાં સુકારા રોગનાં નિયંત્રણ માટે સંક્રમિત છોડથી ૧ મી.ની ત્રિજ્યામાં રહેલ તંદુરસ્ત છોડોમાં પણ સદર માવજત આપવી. બેકટેરીયલ લીફ બ્લાઇટ રોગનાં નિયંત્રણ માટે કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ડબલ્યુપી @ ૨૫ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં આપવું. ખેતરોમાં સુકારો (પેરાવીલ) જોવા મળે તો યુરીયા ૨% પાણીમાં ભેણવી છોડનાં મૂળ વિસ્તારમાં આપવું અને નજીકનાં છોડોમાં હવાની અવર-જવર વધારવા યાંત્રિક રીતે ત થી ૪ કાંદાં મૂળ વિસ્તારમાં પાડવાથી સુકારાગ્રસ્ત છોડોમાં ઝડપી સુધારો થતો હોય છે. છોડમાં જોવા મળતા કુગથી થતાં ટપકાંઓ અને અન્ય બ્લાઇટ જેવાં રોગોનાં વ્યવસ્થાપન માટે કાર્બેન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૪ ગ્રામ અથવા ક્રેસોક્ષીમ મીથાઈલ ૪૪.૩ એસ્સી @ ૧૦ મીલી અથવા પ્રોપીનેબ ૭૦ ડબલ્યુપી

@ २५ ગ્રામ અથવા પ્રોપીકોનાજોલ २५ ઈસી @ १० મીલી અથવા મેટીરામ પ૫% + પાયરોકલોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી @ ૨૦ ગ્રામ અથવા એઝોક્ષાસ્ટ્રોબીન ૧૮.૨% ડબલ્યુ/ડબલ્યુ + ડાયફેનોકોનાજોલ ૧૧.૪% ડબલ્યુ/ડબલ્યુ એસસી @ ૧૦ મીલી/ લી. અથવા ફલુક્ષાપાયરોકસાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાકલોસ્થોથીન ઉત્ત ગ્રામ/ લી. એસસી @ ૬ ગ્રામ ૧૦ લી. પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવાની સલાહ આપવમાં આવે છે.

જુનાગઢ ખાતે ખેડુતોને રાસાયણિક ખાતર (એકર હિંદ ૨૫ કિલો મ્યુરેટ ઓફ પોટાશ અને ૨૫ કિલો પુરીયા બેજવાળી પરિસ્થિતિ હોય ત્યારે) જમીનમાં આપી પાળિયા ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. નિંદામણાની સાફ્ફ-સફાઈ અને આંતર ખેડનાં કાર્યો સમયસર કરવા. જ્યાં હાથથી નિંદામણ શક્ય ન હોય ત્યાં કવીજાલોફોપ ઈથાઈલ ૫ % ઈસી @ ૨ મીલી પ્રતિ લી. પાણીમાં છાંટવું. જો ખેતરમાં મોકોમશી અથવા શ્રીપ્રેસ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો ફલોનીકામીડ ૫૦ ડબલ્યુજી (૨૦૦ ગ્રામ / હે.) અથવા બ્યુવેરીયા બેસીઆના ૬૦ ગ્રામ / ૧૦ લી. પાણી અથવા ફિપ્રોનીલ ૫ એસસી @ ૧૦ મીલી / ૧૦ લી. પાણીમાં બેળવી છંટકાવ કરવો. જો લીલાં તડતડીયાં તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી @ ૩ ગ્રામ / ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. દુંખનાં ચાંચવા (શૂટ વીવીલ)નાં નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ ઈસી @ ૨.૫ મીલી / લી. પાણીમાં બેળવી છાંટવાથી તેનું વ્યવસ્થાપન થઈ શકે છે. કુગથી થતાં રોગોનાં નિયંત્રણ માટે ફલુક્ષાપાયરોકસાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાકલોસ્થોથીન ઉત્ત ગ્રામ/ લી. એસસી @ ૦.૬ ગ્રામ/ લી. અથવા મેટીરામ પ૫% + પાયરોકલોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી @ ૨ ગ્રામ/ લી. પાણીમાં મીશ્ર કરી છાંટવું. સુકારા અથવા મૂળનાં કોહવારા રોગનાં યોગ્ય નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં જોવા મળતાં લક્ષ્ણોને આધારે ટ્રાયકોડર્મા હરજીયમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી છાણિયું ખાતર અથવા સેન્ન્રીય ખાતરમાં બેળવી જમીનમાં ૨.૫ કિલો / હે. મુજબ આપવું અથવા કાર્બન્ડેજીમ ૫૦ વેપા. @ ૧.૨ ગ્રામ/ લી. પાણીમાં બેળવી સંક્રમિત છોડોનાં મૂળ નજીક દરેડવું.

કપાસ ઉત્પાદનની તાંત્રિકતા આધારિત વિસ્તૃત માહિતી દા.ત. જમીનની પસંદગી, જાતો/ સંકરો, ખાતર આપવાની પદ્ધતિ, વાવણીની રીત, પિયત પદ્ધતિઓ, નિંદામણ, કિટકો અને રોગોનું વ્યવસ્થાપન વિગેરેની માહિતી એન્ડ્રોઇડ આધારીત CICR Cotton App. કે જે ICAR-CICR, નાગપુર દ્વારા તૈયાર કરેલ છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય છે. વધુમાં, પાક વૃદ્ધિ અવસ્થા અને હવામાન આધારિત અઠવાડિક સલાહ ICAR-CICR, નાગપુરની વેબસાઈટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે જેનો લાભ ખેડુતો લઈ શકે છે.